



February 11, 2026

To,  
Listing/ Compliance Department  
**BSE LTD.**  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai - 400 001  
**SCRIP CODE: 543748**

To,  
Listing/ Compliance Department  
**National Stock Exchange of  
India Limited**  
“Exchange Plaza”, Plot No. C/1,  
G Block, Bandra Kurla Complex,  
Bandra (E), Mumbai – 400 051  
**SYMBOL: AARTIPHARM**

Dear Sir/Madam,

**Sub: Newspaper Publication of Unaudited Financial Results**  
**Ref: Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations')**

---

In terms of Regulation 47 of the Listing Regulations, the Standalone and Consolidated Unaudited Financial Results for the third quarter and nine months ended December 31, 2025, have been published in the following newspapers:

1. Financial Express (in English) on Wednesday, February 11, 2026;
2. Loksatta – Jansatta (in Gujarati) on Wednesday, February 11, 2026.

A copy of the Newspaper publications is enclosed.

Please take the same on your records.

Thanking you,  
Yours faithfully,  
**For AARTI PHARMALABS LIMITED**

**JEEVAN MONDKAR**  
**COMPANY SECRETARY AND LEGAL HEAD**  
**ICSI M. NO. A22565**  
Encl: a/a

---

**AARTI PHARMALABS LIMITED**

[www.aartipharmalabs.com](http://www.aartipharmalabs.com) | CIN : L24100GJ2019PLC110964 | Email : [info@aartipharmalabs.com](mailto:info@aartipharmalabs.com)

Admin Office : 204, Udyog Kshetra, 2nd Floor, Mulund - Goregaon Link Road, Mulund (W), Mumbai, PIN - 400 080, Maharashtra, INDIA, T : +91 22 67976666 | F : +91 22 25653234  
Regd. Office : Plot No. 22-C/1 & 22-C/2, 1st Phase, G.I.D.C., Vapi 396 195, District - Valsad, Gujarat, INDIA, T : +91 260 2400467, +91 99099 94655

Published in Financial Express (in English) on Wednesday, February 11, 2026.

Regal Resources Limited									
LTD. L1511020125P1 C171000									
Registered Office: 6th Floor, D22, Block - EP & GP Sector V, Salt Lake, Kolkata - 700091, West Bengal									
Ph: 033 35222422 E-mail: info@regal.com Website: www.regalresources.com									
Statement of Unaudited Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2025									
(Rs. in Millions except Earnings per Share)									
S.I. No.	Particulars	Quarter ended			Nine Months ended			Year-to- Date, March, 2025	
		31st Dec 2025	30th Sept 2025	31st Dec 2024	31st Dec 2025	Unaudited	Unaudited		
1.	Revenue from Operations:								
2.	Other Income	3,228.70	3,290.73	3,212.25	8,095.62	8,568.23	9,151.81		
3.	Total Income (1+2)	3,228.70	3,290.73	3,212.25	8,095.62	8,568.23	9,151.81		
4.	(a) Cost of Materials Consumed	1,301.95	1,286.62	1,647.85	3,980.59	3,705.73	3,260.83		
	(b) Purchases of Stock-in-Trade	1,427.95	1,075.78	308.35	2,971.27	166.28	1,480.43		
	(c) Changes in Inventories of Finished goods, Stock-in-Trade								
	(d) Purchase of Fixed Assets	(364.62)	50.44	(193.86)	(173.53)	(302.77)	(103.23)		
	(e) Employment Bona Fide Expenses	58.42	62.85	63.22	221.47	188.05	246.44		
	(f) Finance Costs	68.75	80.68	78.15	245.93	273.48	305.50		
	(g) Professional and Consultancy Expenses	26.45	26.45	27.11	79.91	81.11	83.50		
	(h) Other Expenses	378.94	361.86	303.30	1,040.55	843.63	1,131.20		
	Total Expenses	<b>2,902.61</b>	<b>2,070.58</b>	<b>2,378.25</b>	<b>8,219.83</b>	<b>8,605.92</b>	<b>9,337.77</b>		
5.	(a) Profit Before Exceptional Items (1-4) and (g-i)	342.09	219.15	233.13	1,875.80	952.31	812.04		
	(b) Exceptional Items (Refer Note 7-e)	48.37	52.13	154.50	261.13	154.50	261.13		
	Profit/Loss Before Tax (5-i)	<b>374.46</b>	<b>271.32</b>	<b>349.63</b>	<b>1,137.94</b>	<b>951.81</b>	<b>495.97</b>	<b>527.92</b>	
6.	(a) Current Tax	38.85	45.53	34.96	33.77	88.05	195.80		
	(b) Deferred Tax	11.92	10.54	17.35	33.98	38.32	54.71		
	Total Tax Expenses	<b>50.77</b>	<b>56.07</b>	<b>52.30</b>	<b>67.75</b>	<b>126.37</b>	<b>149.51</b>	<b>149.51</b>	
7.	Profit/Loss For the period (Year-to-Date)	<b>323.46</b>	<b>215.22</b>	<b>349.63</b>	<b>1,069.19</b>	<b>825.44</b>	<b>367.47</b>	<b>478.60</b>	
8.	Other Comprehensive Income:								
	(a) Net gain/loss on Translation of foreign operations								
	(b) Net gain/loss on fair value of biological assets	7.82	1.71	(0.92)	3.32	1.13	1.13		
	(c) Income tax on net reclassification	(0.45)	1.83	8.24	(38.91)	(32.61)	(6.53)		
	Total Other Comprehensive Income (b+c)	<b>7.37</b>	<b>3.54</b>	<b>7.31</b>	<b>(35.58)</b>	<b>(29.48)</b>	<b>(5.40)</b>	<b></b>	
9.	Total Profit/Loss for the period (Year-to-Date)	<b>330.83</b>	<b>218.76</b>	<b>356.94</b>	<b>1,033.61</b>	<b>822.82</b>	<b>362.07</b>	<b>478.60</b>	
10.	Equity Capital for the period (Year-to-Date)	<b>533.87</b>	<b>188.45</b>	<b>241.81</b>	<b>382.72</b>	<b>362.72</b>	<b>478.60</b>		
11.	Total Paid-up Equity Capital for the period (Year-to-Date)	<b>913.42</b>	<b>913.42</b>	<b>416.68*</b>	<b>615.68</b>	<b>416.68*</b>	<b>416.68</b>		
12.	Paid-up Equity Capital (Face Value Rs.5/-each)								
	(a) Other Equity								
	(b) Capital for the period (Year-to-Date)								
	(c) Basic	1.21	1.88	1.87	4.23	4.78*	9.95		
	(d) Diluted	1.25	1.84	1.79*	4.19	4.43*	6.63		

Plates: Kolkata  
Date : 18.02.2026



Sell:  
Avil Kishorepuria  
(Chairman & Managing Director)  
9999724328

 <b>QGO FINANCE LIMITED</b> <small>CIN : L59599MH1993PLC22406</small>
<small>Regd Office: 3rd Floor, A514, TTC Industrial Area, MIDC, Mahape, Navi Mumbai - 400701            E. Contact us : <a href="mailto:egofinance.com@webmail.com">egofinance.com@webmail.com</a>   Tel No.: +91-9857400776</small>
<b>[Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015]</b>
<b>BSE Code - 538646</b>
<b>Extract of Un-Audited Financial Results for the quarter and nine months ended December 31, 2025</b>
<b>The Un-Audited Financial Results of QGO Finance Limited ("the Company") along with the Limited Review Report received from the Statutory Auditors of the Company for the Quarter and nine months ended December 31, 2025 have been reviewed by the Audit Committee and approved by Board of Directors of the Company at their Meetings held on February 09, 2026, in terms of Regulation 33 of the Securities and Exchange Board of India (Lasting Obligations and Disclosure Requirements) Regulations, 2015.</b>
<b>The Un-Audited Financial Results and Limited Review Report of the Statutory Auditors thereof are available on the website of BSE (<a href="http://www.bseindia.com">www.bseindia.com</a>) and on the Company's website at <a href="http://qgofinance.com">http://qgofinance.com</a>. The same can also be accessed by scanning the QR Code provided below.</b>
<b>By order of the Board            For QGO Finance Limited            ad/            Rachana Singh            Managing Director            DIN 03166500</b>

	<p style="text-align: center;"><b>DHARMAJ®</b> <b>CROP GUARD LIMITED</b></p>
<p><b>DHARMAJ CROP GUARD LIMITED</b></p>	
<p>Regd. Office - Plot No. 408 to 411, Kerala GIOC Estate, Off NH-8, At: Kerala, Tx - Savia, Ahmedabad- 382220. website: <a href="http://www.dharmajcrop.com">www.dharmajcrop.com</a>, email: <a href="mailto:cs@dharmajcrop.com">cs@dharmajcrop.com</a>, CIN: L24100GJ2015PLC081941</p>	
<p><b>CONSOLIDATED AND STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2025</b></p>	
<p>Pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, based on the recommendation of the Audit Committee, the Board of Directors of the Dharmaj Crop Guard Limited at its meeting held on February 10, 2028, has approved the Standalone and Consolidated Un-audited Financial Results for the Quarter and Nine months ended on December 31, 2025 along with Limited Review Report issued by the Statutory Auditor of the Company.</p> <p>The aforementioned financial results along with the Limited review report of the Statutory Auditors thereon are available on the Stock Exchange websites, <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> / <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> and website of the company <a href="http://www.dharmajcrop.com">www.dharmajcrop.com</a> and the said financial results can also be accessed by scanning a Quick Response (QR) Code given below:-</p>	
 <b>SCAN ME</b>	<p><b>For and on Behalf of Board</b> <b>Dharmaj Crop Guard Limited</b> <b>SD-1</b></p> <p><b>Mr. Rameshbhai Ravajibhai Talavia</b> <b>Chairman &amp; Managing Director</b> <b>(DIN - 01619743)</b></p>

EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS						
Sr. No.	Particulars	Quarter ended		Nine months ended		Year ended 31st March, 2009
		31st December, 2008 (Unaudited)	30th September, 2009 (Unaudited)	31st December, 2008 (Unaudited)	31st December, 2009 (Unaudited)	
1.	Revenue from operations	2,025.05	1,762.79	938.77	1,631.13	2,857.01
2.	Profit before exceptional items and tax	231.08	178.12	29.00	420.81	210.04
3.	Profit after tax	231.08	178.12	29.00	420.81	219.04
4.	Net profit after tax	186.21	150.93	38.42	367.71	169.68
5.	Dividend paid by the Company to its owners of the Company	161.76	104.59	33.42	332.55	166.94
6.	Total comprehensive income attributable to owners of the Company	186.21	150.17	33.22	357.87	192.05
7.	Profit after tax and Capital (Value of share MR 2 each)	111.91	111.81	111.07	111.81	111.57
8.	Other equity attributable to owners of the Company	-	-	-	-	4,326.45
9.	Equity (MR 100 each) (EPS)	3.25	2.36	0.55	3.01	3.08
	Diluted EPS (P/s)	3.25	2.36	0.51	2.81	3.07
	(Net) attributable to equity (in lakhs)	3.25	2.36	0.55	3.01	3.08
	(Net) attributable to equity (in lakhs)	3.25	2.36	0.55	3.01	3.08
	(Net) attributable to equity (in lakhs)	3.25	2.36	0.55	3.01	3.08
EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS						
Sr. No.	Particulars	Quarter ended		Nine months ended		Year ended 31st March, 2009
		31st December, 2008 (Unaudited)	30th September, 2009 (Unaudited)	31st December, 2008 (Unaudited)	31st December, 2009 (Unaudited)	
1.	Revenue from operations	1,768.19	1,768.19	933.27	1,630.63	3,869.11
2.	Profit before exceptional items and tax	238.74	165.68	30.06	436.91	214.86
3.	Profit after tax	238.74	165.68	30.06	436.91	214.86
4.	Net profit after tax	164.58	115.89	29.16	329.07	169.78
	The above is an extract of the detailed format of quarterly financial results as available with the stock exchanges. The quarterly financial results in the detailed format can be availed on the Company's website at <a href="http://www.jnkindia.com">www.jnkindia.com</a> on the website of BSE ( <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> ) and NSE ( <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> ).					
	The Company's management consists of Combination of Executive and Process. Segment reporting is included in unaudited consolidated financial statements in the notes.					
	For the period for which the financial results have been released by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 30th February, 2009.					
	The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 30th February, 2009.					
	By order of the Board For JNK India Limited Anil Khandekar Chairman & Whole Time Director DIN: 00061001					

